

November 1, 2025

To,
Corporate Relations Department
BSE Limited
2nd Floor, P.J. Towers,
Dalal Street,
Mumbai – 400 001

SCRIP CODE: 532056

Subject: Newspaper Publication for the Unaudited Standalone Financial Results of the Company for the quarter and half year ended on 30th September, 2025- Regulation 47 of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Dear Sir/Madam,

In compliance with regulation 47 and other applicable provisions of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find herewith enclosed copy of newspaper advertisement published on Saturday, 1st November, 2025 in the Business Standard (English) and Jai Hind (Gujarati) wherein Unaudited Standalone Financial Results of the Company for the quarter ended and half year ended on 30th September, 2025 as approved by the Board of Directors of the Company at its meeting held on Friday, 31st October, 2025 have been published.

This intimation will also be uploaded on the company's website at www.trustedgecapital.in.

You are requested to take the same on your records.

Thanking you,

Yours faithfully,

**For, Trustedge Capital Limited
(Formerly known as Adinath Exim Resources Limited)**



**Pinkal Mehta
Company Secretary & Compliance Officer
Membership No.: A59075**



+91 70696 00260

info@trustedgecapital.in

www.trustedgecapital.in

REGI.OFFICE: OFFICE NO. 308, 3RD FLOOR, BLOCK-B, NAVRATNA CORPORATE
PARK, BODAKDEV, AHMEDABAD – 380058, GUJARAT, INDIA.

CIN:L65100GJ1995PLC024300

TRUSTEDGE CAPITAL LIMITED (FORMERLY KNOWN AS ADINATH EXIM RESOURCES LIMITED)

UCO BANK
Bhurch Branch, 1st Floor, Shalimar Complex, Station Road, Bhurch - 392001.
Email: branch@ucobank.co.in | Ph: 0242-2436470
Date: 18/08/2025
Loan A/C Number: 03110610013052

To: Mr. Mansuri Parvez S/O Iqbal Gulam Mansuri, Mrs. Mansuri Tasnim W/O Mr. Mansuri Parvez
Adt: B-5, Umar Faruk Complex, Patel Wadi, Juna Kosamba, Ta. Mangrol, Tarsadi, Dist. Surat - 394120.
Sub: Notice u/s 13(2) of Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002.

Dear Sirs,

1. At your request, you have been granted by UCO Bank, through its **Bhurch Branch**, from time to time, various credit facilities by way of financial assistance against various assets creating security interest in favour of the Bank. The relevant particulars of the said credit facilities available by you and the security agreements(s)/document(s) executed by you are stated in Schedule 'A' and 'B' of this notice respectively excluding pledge of movables. You have availed the financial assistance with an undertaking for repayment of the said financial assistance in terms of the said agreement(s)/document(s).

2. You have also created mortgage by way of deposit of title deeds/registered mortgages creating security interest in favour of the Bank. The documents relating to such mortgage are also stated in Schedule 'B'.

The relevant particulars of the secured assets are specifically stated in Schedule 'C'. All the piece and parcel of immovable property bearing, R.S. No. 540-1, Palike Moon Light Residency Palkes Ground floor, Shop No. 6/1 BUA 11.75 sq. mt. & Shop No. 6/2 BUA 11.75 sq. mt., Total Ad area 23.50 sq. mt. situated at Shri of Tarsadi, Ta. Mangrol, District - Surat, Gujarat, Pin - 394120 registered with SMT Mangrol. (Mortgage deed of property vide serial no. 284/2024 dated 10/01/2024) East - Society Road, West - Society Road, North - Adjoining Shop No. 3, South - Land of Adjoining Plot.

3. You have also acknowledged subsistence of the liability in respect of the aforesaid credit facilities by executing confirmation of balances and revival letters and other documents from time to time. The operation of and conduct of the above said financial assistance/ credit facilities have become irregular and the debt has been classified as non-performing asset on 28/07/2023 in accordance with the directives/guidelines relating to asset classification issued by the Reserve Bank of India consequent to the default committed by you in repayment of the principal debt and interest thereon.

4. Despite repeated requests, you have failed and neglected to repay the said dues / outstanding liabilities. Therefore, the Bank hereby calls upon you u/s 13(2) of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, by issuing this notice to discharge the debt within 60 days from the date of this notice. Your outstanding liabilities (in aggregate) due and owing to the Bank are in the sum of **Rs. 20,83,817.00 (Rupees Twenty Lakh Three thousand Eight Hundred Seventeen and Only (inclusive of interest upto 30.03.2025))**. You are also liable to pay future interest at the contractual rate on the aforesaid amount together with incidental expenses, cost, charges, etc.

5. If you fail to repay to the Bank the aforesaid sum of **Rs. 20,83,817.00 (Rupees Twenty Lakh Three thousand Eight Hundred Seventeen and Only (inclusive of interest upto 30.03.2025))** with further interest and incidental expenses, costs as stated above in terms of this notice u/s 13(2) of the Act, the Bank will exercise all or any of the rights detailed under sub-section (4) of Section 13 and under other applicable provisions of the said Act.

6. You are also put on notice that in terms of sub-section 13 of Section 13 you shall not transfer by sale, lease or otherwise the said secured assets detailed in Schedule 'C' of this notice without obtaining written consent of the Bank.

7. The Bank reserves its rights to call upon you to repay the liabilities that may arise under the outstanding Bills Discounted, Bank Guarantees and Letter of Credit issued and established on your behalf as well as other contingent liabilities.

8. The notice is issued without prejudice to the Bank's right to initiate such other actions or legal proceedings as it deems necessary under any other applicable provisions of Law.

Yours Faithfully,
Authorised Officer, UCO Bank

SOLAPUR MUNICIPAL CORPORATION
PUBLIC E-TENDER NOTICE

A tender has been published on been published on the website <https://mahatenders.gov.in> CONSTRUCTION INSTALLATION AND COMMISSIONING OF TRANSFORMER INCLUDING CIVIL, MECH. & ELECTRICAL WORK UNDER SBM 2.

Tender ID-2025_SMC_1273830_1

Detail information about the said work is available for viewing on the website <https://mahatenders.gov.in> from 31/10/2025 To 10/11/2025

Commissioner
Solapur Municipal Corporation

ADITYA BIRLA CAPITAL
Registered Office- Indian Rayon Compound, Verval, Gujarat- 362266 Branch Office- Office No. 311 & 315, 3rd Floor, Aditya Birla House, Near Ganga Diamond Showroom, 1 Lal Bahadur Shastri Road, Bapunagar, Ahmedabad-380002.

APPENDIX IV
[See Rule 8 (1) of the Security Interest (Enforcement) Rules, 2002]
Possession Notice (For Immovable Property)

Whereas, the undersigned being the authorized officer of Aditya Birla Housing Finance Limited under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(2) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 has issued a demand notice dated 13-08-2025 calling upon the borrowers KUSHWAHA JADAVATI & KUSHWAHA SUSHIL ANANT mentioned in the notice being of Rs. 45,53,126 (Rupees Forty Five Lakh Fifty Three Thousand One Hundred Twenty Six Only) within 60 days from the date of receipt of the said notice. The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrowers and to the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of the powers conferred on him under sub-section 13(4) of the said Act, read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this 28th day of October of the year, 2025.

The borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Aditya Birla Housing Finance Limited for an amount of **Rs. 45,53,126 (Rupees Forty Five Lakh Fifty Three Thousand One Hundred Twenty Six Only)** interest thereon. Borrowers attention is invited to the provisions of Sub-section 8 of Section 13 of the Act, in respect of time available, to redeem secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY
All That Piece And Parcel Of Property Being A Flat No. 502, On 6th Floor, In Block No. 'E', Addressing 70.3 Sq. Meters Area Carpet Area, 3.88 Bungalow Area, In The Scheme 'Shyam Kulk', Constructed On Non-Agricultural Land Bearing Block No. 13a, T.P. Scheme No. 102, Final Plot No. 53, Situated, Lying And Being At Mouja Hanspur, Taluka Asava, In The Registration District Ahmedabad And Sub District (Naroda) Ahmedabad, Gujarat, 382330 And Bounded As: East: Passage Thru Staircase West: Internal Road North: Flat No F501 South: Flat No F501

Date: 28.10.2025 Place: Ahmedabad
Aditya Birla Housing Finance Limited

TRUSTEDGE CAPITAL LIMITED
(Formerly known as Adinath Exim Resources Limited)
CIN: L65100GJ1995PLC024300
Office No. 308, 3rd Floor, Block-B, Navratna Corporate Park, Bodakdev, Bopal, Ahmedabad, Daskroi- 380058, Gujarat, India.
Ph: 6351738619, E-mail: cs@trustedgecapital.in, Website: www.trustedgecapital.in

EXTRACTS OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED ON 30TH SEPTEMBER, 2025

The Full format of the unaudited standalone financial results for the quarter and half year ended on 30TH September, 2025 are available on the Stock Exchange(s) website (www.bseindia.com) and on the Company's website (www.trustedgecapital.in). The same can be accessed by scanning the QR Code provided below.

By Order of the Board
For Trustedge Capital Limited
(Formerly known as Adinath Exim Resources Limited)
Sd/-
Manoj S. Savla
Chairman & Managing Director - DIN: 01529306

IDBI BANK LIMITED - RANDER ROAD BRANCH
Harim Complex, Beside ICICI Bank, Aditya Birla House, Near Ganga Diamond Showroom, 1 Lal Bahadur Shastri Road, Bapunagar, Ahmedabad-380002.

POSSESSION NOTICE - (For Immovable Property)
Whereas, the undersigned being the authorized officer of IDBI Bank Limited under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of the powers conferred under Section 13(2) read with rule 3 of Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice dated August 6, 2025 calling upon the borrower Shri Abdulrazak Habbibul Arabi (Borrower and Mortgagee) (Deceased), Smt. Sharifan Rajabkhat Arbiyani (Co-Borrower) and Shri Wahid R Arbiyani (Co-Borrower) to repay the amount mentioned in the notice being **Rs.18,54,444.64 (Rupees Eighteen Lakh Fifty four thousand Four Hundred and Forty four and sixty-four paise only)** as on July 9, 2025 and interest thereon within 60 days from the date of the receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below, in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of the said Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this 28th day of October of the year 2025.

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of IDBI Bank Limited for an amount of **Rs.18,54,444.64 (Rupees Eighteen Lakh Fifty four thousand Four Hundred and Forty-four and sixty-four paise only)** as on July 9, 2025 and interest thereon.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Description of the Immovable Property
All The Pieces and parcels of immovable property i.e. Plot No. 1 measuring 107 sq. mtrs of Unit C in Nilam Row House of Shree Satguru Co-Op Hsg Soc., Near Patel Pump, Umra, Udhna, Udhna Sachin Road, Surat-394210, Gujarat constructed on Survey land bearing Block No.73 palki, land measuring 16208 sq. mtrs in Narval T.P. Scheme No. 122 situated at Mogi- Um, Taluka: Choryasi, District: Surat, Gujarat with internal and external rights and which is bounded as follows: On the East by: Open land, On the West by: Plot No. C/2, On the South by: Society Internal Road, On the North by: Hamid Nagar.

Together with all buildings and structures thereon and all plant and machinery attached to the earth or permanently fastened to anything attached to the earth.

Date: 28.10.2025 Place: Surat
Sd/ Authorised Officer, IDBI Bank Ltd.

Muglisara Branch, LIC Building, Opp. Surat Municipal Corporation, Phat-380009, Ph. 0261-2428820, Email: muglis@ucobank.co.in

NOTICE TO THE BORROWER
Date: 10/09/2025

To: Mr. Bhavesh Jarambhai Tejani, Mrs. Sonalben Bhaveshbhai Tejani
Adt: Flat No. A/501 Panel Palaces, Opposite White House, Mota Varachha Surat - 394011.
Sub: Notice u/s 13(2) of Securitisation And Reconstruction Of Financial Assets And Enforcement Of Security Interest Act, 2002 (Hereinafter Called 'Act').

Dear Sirs,

1. At your request, you have been granted by UCO Bank, through its **Muglisara Branch** (located at Flat No. A/501 Panel Palaces, Opposite White House, Mota Varachha Surat - 394011), from time to time, various credit facilities by way of financial assistance against various assets creating security interest in favour of the Bank. The relevant particulars of the said credit facilities available by you and the security agreements(s)/document(s) executed by you are stated in Schedule 'A' and 'B' of this notice respectively excluding pledge of movables. You have availed the financial assistance with an undertaking for repayment of the said financial assistance in terms of the said agreement(s)/document(s).

2. You have also created mortgage by way of deposit of title deeds/registered mortgages creating security interest in favour of the Bank. The documents relating to such mortgage are also stated in Schedule 'B'.

The relevant particulars of the secured assets are specifically stated in Schedule 'C'. All the piece and parcel of immovable property bearing thereon Flat No. A/501 measuring Built-up area about 95.25 sq. meters on the 10th floor of the Building No. 'A' together with proportionately undivided share in the land underneath the said building with all appurtenances and rights detailed under Sub-Section (4) of Section 13 and under other applicable provisions of the said Act.

3. You have also acknowledged subsistence of the liability in respect of the aforesaid credit facilities by executing confirmation of balances and revival letters and other documents from time to time. The operation of and conduct of the above said financial assistance/ credit facilities have become irregular and the debt has been classified as non-performing asset on 12/02/2025 in accordance with the directives/guidelines relating to asset classifications issued by the Reserve Bank of India consequent to the default committed by you in repayment of principal debt and interest thereon.

4. Despite repeated requests, you have failed and neglected to repay the said dues/outstanding liabilities.

5. Therefore, the Bank hereby calls upon you u/s 13(2) of the said Act by issuing this notice to discharge the debt within 60 days from the date of this notice. Your outstanding liabilities (in aggregate) due and owing to the Bank is in the sum of **Rs. 40,74,964.37 (Rupees Forty Lakh Seventy four thousand nine hundred sixty four rupees and thirty seven paise only)** as on 12/02/2025 (inclusive of interest up to 30.10.2024). You are also liable to pay future interest at the contractual rate on the aforesaid amount together with incidental expenses, cost, charges, etc.

6. If you fail to repay to the Bank the aforesaid sum of **Rs. 40,74,964.37 (Rupees Forty Lakh Seventy four thousand nine hundred sixty four rupees and thirty seven paise only)** as on 12/02/2025 (inclusive of interest up to 30.10.2024) with further interest and incidental expenses, costs as stated above in terms of this notice u/s 13(2) of the Act, the Bank will exercise all or any of the rights detailed under sub-section (4) of Section 13 and under other applicable provisions of the said Act.

7. You are also put on notice that in terms of Sub-Section 13 of Section 13 you shall not transfer by sale, lease or otherwise the said secured assets detailed in Schedule 'C' of this notice without obtaining written consent of the Bank.

8. The Bank reserves its rights to call upon you to repay the liabilities that may arise under the outstanding Bills Discounted, Bank Guarantees and Letter of Credit issued and established on your behalf as well as other contingent liabilities.

9. This notice is issued without prejudice to the Bank's right to initiate such other actions or legal proceedings as it deems necessary under any other applicable provisions of Law.

In the event of issuance of this notice, previous notice issued vide paper publication dated 17 June 2025 stands withdrawn and recalled.

Date: 10/09/2025
Yours Faithfully, Chief Manager & Authorised Officer, UCO Bank

HIMACHAL PRADESH PUBLIC WORKS DEPARTMENT
INVITATION FOR BIDS (IFB)

The Executive Engineer, Himachal Pradesh H.P.W.D., Shimla on behalf of Government of H.P. invites the Percentage Rate bids, in electronic tendering system, from the eligible class of contractors registered with H.P.W.D. for the works as detailed in the table.

Sr. No.	Name of Work	Estimated cost	Starting Date for download of Bid	Earnest money	Deadline for submission of Bid	Time Period
1	Cio 68.80 M span Jeeapable Bridge over Seer Khad on Bar Mathendras Dargah (Panoidad) at RD 0800 (SH: Cio Sub-Structure)	Rs. 3340783/-	03-11-2025	Rs. 668154/-	09-11-2025	Twelve Month
2	Restoration of rain damages on Ghanuman Bin Bin Shalimar road km 0/00 to 4/00 (SH: Cio Sub-Structure)	14955002/-	03-11-2025	299110/-	09-11-2025	Three Month
3	Restoration of rain damages on Bin Bin Chhat Anjala road km 0/00 to 10/00 (SH: Cio Sub-Structure)	12566624/-	03-11-2025	Rs. 251332/-	09-11-2025	Three Month
4	Cio Motor Sewal Gallan Sukkar Khad road km 0/00 to 8/150 (SH: Cio RHP Pipe Culvert road m. da at Dist. 0460 08/75,10/10,17/72,39/40,39/60 and Cio RCC Pipe 5 mtr span culvert at RD 0800 to 08/30 and Cio Sub-Structure at RD 2185 to 22/10 Cio Sub-Structure at RD 2180 to 22/06, PI GSB and CC Pavement at RD 2180 to 22/06)	7499405/-	03-11-2025	149888/-	09-11-2025	Three Month
5	Restoration of rain damages on Bum Dipper Halwar road km 0/00 to 3/00 (SH: Cio Sub-Structure at various Rds) and Cio V-shape drain at various Rds under PDNA 2023.	9616482/-	03-11-2025	192330/-	09-11-2025	Three Month

The Technical Bid of the above tenders will be open on dated 10/11/2025 at 10:00AM. The bidders are advised to note details of tenders from the department website www.hpdtenders.gov.in.

Executive Engineer,
Ghanuman, Division, H.P.W.D., Shimla
(on behalf of Government of Himachal Pradesh)

ONELIFE CAPITAL ADVISORS LIMITED
Address: Plot No. A 356, Road No. 26, Vaghai Industrial Estate, MIDC, Thane (W), Maharashtra, 400004. CIN: L7410MH2007PLC136660 Tel: 02241942345.
Email: cs@onelifecapital.in Website: www.onelifecapital.in

Statement of Consolidated Unaudited Financial Results for the Quarter and Half Year Ended September 30, 2025
(Figures in Rs. lakhs unless stated otherwise)

S. No.	Particulars	Quarter Ended		Half Year Ended		Year Ended
		30.09.2025	30.06.2025	30.09.2024	30.06.2024	
1	Total Income from operations	385.97	94.07	151.04	470.63	972.21
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	(465.40)	(34.52)	(2,403.65)	(499.92)	(2,308.95)
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	(465.40)	(34.52)	(661.08)	(499.92)	(666.38)
4	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	(462.87)	(52.51)	(680.47)	(535.18)	(615.55)
5	Total Comprehensive income for the period (Comprising Profit/Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)	(462.87)	(52.51)	(680.47)	(535.18)	(615.55)
6	Equity Share Capital (FV of Rs. 10 per share)	1336.00	1336.00	1336.00	1336.00	1336.00
7	Earnings Per Share (FV of Rs. 10 each) (for continuing and discontinued operations)	1336.00	1336.00	1336.00	1336.00	1336.00
8	Basic and Diluted	(3.61)	(0.39)	(5.09)	(4.01)	(4.61)

The key standalone financial information is as under:

S. No.	Particulars	Quarter Ended	Half Year Ended	Year Ended
1	Total Income from operations	300.00	-	300.00
2	Net Profit / (Loss) for the period before tax	198.46	(61.64)	271.64
3	Net Profit / (Loss) for the period after tax	164.25	(61.64)	230.14

The above is an extract of the detailed format of Quarterly Half Yearly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Half Yearly Financial Results are available on the Company's website www.onelifecapital.in and also the Stock Exchange websites www.bseindia.com and www.nseindia.com.

The above unaudited standalone and consolidated financial results have been reviewed and recommended by the Audit Committee at their meeting held on 30 October 2025 and consequently approved by the Board of Directors at their meeting.

For and on behalf of the Board of Directors
Onelife Capital Advisors Limited
Prabhu Raju Naidu
Whole Time Director
DIN: 00716975

CONTINENTAL CONTROLS LIMITED
CIN: L66110MH1995PLC086040
Address: A-356/357, Road No. 26, Vaghai Industrial Estate, MIDC, Thane (West), Maharashtra, India - 400004.
Tel: 02241842289 | Email: compliance@continentalcontrol.in | Website: www.continentalcontrol.in

Statement of Unaudited Financial Results for the Quarter and Half Yearly Ended September 30, 2025
(Figures in Rs. lakhs unless stated otherwise)

Sr. No.	PARTICULARS	Quarter Ended		Half Year Ended		Year Ended
		30.09.2025	30.06.2025	30.09.2024	30.06.2024	
1	Total Income from operations	4.70	4.64	4.72	11.62	10.92
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	(1.53)	0.77	1.35	(0.76)	4.78
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	(1.53)	0.77	1.35	(0.76)	4.78
4	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	(1.53)	0.77	1.35	(0.76)	4.78
5	Total Comprehensive income for the period (Comprising Profit/Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)	(1.53)	0.77	1.35	(0.76)	4.78
6	Equity Share Capital (FV of Rs. 10 per share)	614.63	614.63	614.63	614.63	614.63
7	Earnings Per Share (FV of Rs. 10 each) (for continuing and discontinued operations)	(0.02)	0.01	0.02	(0.01)	0.08

Notes:

1. The Statement of financial results have been prepared in accordance with Indian Accounting Standards (Ind AS) as prescribed under Section 133 of the Companies Act 2013, read with Rule 3 of the Companies (Indian Accounting Standards) Regulations, 2015. Companies (Indian Accounting Standards) (Amendment) Rules, 2016 and other accounting principles generally accepted in India. There is no minority interest.

2. The above financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meetings held on October 30, 2025 and have been reviewed by the Statutory auditors of the Company.

3. Management reporting as per the Accounting Standards 108 is applicable as the Company operates only one segment i.e. Advisory Services.

4. Previous years' periods figures have been regrouped or reclassified wherever necessary with the figures of the current period.

5. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Company's website www.continentalcontrol.in and also the Stock Exchange websites www.bseindia.com. The same can be accessed by Scanning the QR code provided.

For and on behalf of the Board of Directors
Continental Controls Limited
Sd/-
Rajesh Kumar Puri
Whole Time Director
DIN: 01096119

DEBTS RECOVERY TRIBUNAL, JAIPUR
First Floor, Sudhama-II, Lal Kothis Shopping Center, Tonk Road, Jaipur - 302015

DEMAND NOTICE
Notice under Section 25 to 28 of the Recovery of Debts & Bankruptcy Act, 1993 and Rule 2 of Second Schedule to the Income Tax Act, 1961
Dispatch No. 08TUP/6159
Date: 28.09.25
Next date: 17.11.2025

Omikara Assets Reconstruction Private Limited
Versus
M/s Sarvotam Industries Ltd. & ors.

1. Hemant Kabra, Adult Indian in-habitant, R/o C-123, Udaipath, Shyamnagar, Jaipur (Raj.)
2. Arvind Kabra, Adult Indian in-habitant, R/o B-2, Patel Society, Shahibhag, Ahmedabad-380004 (Gujarat).
3. Kamia Craft Pack Private Limited, A Private Limited Company, Registered Office at 26-B, Vijay Colony, Near Stadium Marg, Post Office Narangpur, Ahmedabad (Gujarat), through its Authorized Director.
4. Kabra Investment Private Limited, A Private Limited Company, Registered Office at 26-B, Vijay Colony, Near Stadium Marg, Post Office Narangpur, Ahmedabad-380013 (Gujarat), through its Authorized Director.
5. Baroda Private Limited, A Private Limited Company, Registered Office at 26-B, Vijay Colony, Near Stadium Marg Post Office, Narangpur, Ahmedabad-380013 (Gujarat) through its Authorized Director.

This is to notify that as per the Recovery Certificate issued in pursuance of orders passed by the Presiding Officer, Debts Recovery Tribunal, Jaipur in O.A. No. 57/2002 an amount of **Rs.29,99,30,000/-** (Rupees Twenty nine crores ninety nine lakhs thirty thousand only) and interest thereon as per Recovery Certificate is due against you.

1. You are hereby directed to pay the above sum within 15 days of the receipt of the notice, failing which the recovery shall be made in accordance with the Recovery of Debts & Bankruptcy Act, 1993 and Rules made there under.

2. You are, hereby ordered to declare on an affidavit the particulars of your assets on or before the next date of hearing.

3. You are hereby ordered to appear before the undersigned on 17.11.2025 at 10.30 a.m. for further proceedings.

4. In addition to the sum aforesaid you will be liable to pay:

(a) such interest as is payable for the period commencing immediately after this notice of the certificate/execution proceedings.

(b) All costs, charges and expenses incurred in respect of the service of this notice and warrants and other processes and all other proceedings taken for recovering the amount due.

Details of amount in the recovery certificate due against you

1. Recovery Certificate Amount	Rs.29,99,30,000.00
1. Cost of Suit	Rs.1,53,122.00
2. Interest from 01.02.2002 to 10.09.2025 @10% on principal amount	Rs.70,84,92,181.00
4. Amount received after PC issued	Rs.1,23,00,000.00
5. Total	Rs.99,62,75,303.00

(Principal Cost Interest - amount recovered) (Rupees ninety nine crores thirty two lakhs thirty five thousand three hundred three)

Note: Subject to payment/receipt, if any, made during pendency of OA or Recovery, if any, made by way of action under SARFAESI.

Given under my hand and the seal of the Tribunal, on this date: 26/09/2025

Recovery Officer
Debts Recovery Tribunal, Jaipur

By Order of the Board
For Trustedge Capital Limited
 (Formerly known as Adinath Exim Resources Limited)
 Sd/-
Manoj S. Savia
 Chairman & Managing Director - DIN: 01529306